

મંડળની જાહેરાત ક્રમાંક : ૧૪૪/૨૦૧૭૧૮ના ઉમેદવારોની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ભાગ-૧ Preliminary Examination (screening test-Objective Type) તેમજ ભાગ-૨ માં Physical Screening Test માં ક્વોલીફાઈ થયેલ ઉમેદવાર ભાગ-૩ Main Exam(Objective Type / Witten Examination) માટે લાયક ઠરેલ, અને ભાગ-૩ કસોટીમાં મેળવેલ ગુણના આધારે લાયક ઠરેલ ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે. તેવા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમની ઉમેદવારો માટેની સૂચનાઓ.

સંબંધિત ઉમેદવારોને તારીખ ૧૬/૦૮/૨૦૧૮ના રોજ વેબસાઈટ પરની યાદીમાં દર્શાવેલ ઉમેદવારોને તા.૨૭/૦૮/૨૦૧૮ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે નીચેના સ્થળે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે.

સ્થળ:- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,

બ્લોક નં.-૨, પહેલો માળ, "કર્મચોગી ભવન", સેક્ટર-૧૦/એ,

નિર્માણ ભવનનીપાછળ, ગાંધીનગર- ૩૮૨ ૦૧૦ ની કચેરી ખાતે.

તમામ ઉમેદવારોએ ઉપરોક્ત સ્થળે નીચેના અસલ પ્રમાણપત્રો/દસ્તાવેજો અને તેનો, સ્વ-પ્રમાણિત કરી અને તેની નીચે સહી કરેલો ૧ ઝેરોક્ષ સેટ તેમજ પાસપોર્ટ સાઇઝનો એક ફોટો અચૂક સાથે લાવવાના રહેશે.

૧. (ક) ધોરણ-૧૨ની માર્કશીટ અથવા પ્રમાણપત્ર

(ખ) ધોરણ-૧૦ની માર્કશીટ અથવા પ્રમાણપત્ર

(ગ) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

૨. સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૨૦૦૮ના ઠરાવ મુજબનું કોમ્પ્યુટરના બેઝીક નોલેજ બાબતનું પ્રમાણપત્ર

૩. એસ.સી./એસ.ટી./એસ.ઇ.બી.સી. વર્ગના ઉમેદવારો માટે જાતિ અંગેનું સક્ષમ અધિકારી ધ્વારા અપાયેલ પ્રમાણપત્ર

૪. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવા અંગેનું નિયત નમૂનાનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૨૭/૦૪/૨૦૧૦ના ઠરાવથી નિયત થયેલ પરિશિષ્ટ-૪ ના નમૂનામાં તા.૦૧/૦૪/૨૦૧૫ થી તા.૩૧/૦૩/૨૦૧૬ના સમયગાળાની આવકને ધ્યાને લઈ, તા.૦૧/૦૪/૨૦૧૬ થી તા.૦૧/૦૧/૨૦૧૭ સુધીના સમયગાળાનું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવા અંગેનું પ્રમાણપત્ર અરજીમાં દર્શાવ્યા મુજબના પ્રમાણપત્રના નંબર અને તારીખવાળું લાવવાનું રહેશે.

૫. અરજીપત્રકમાં રમતગમતની વિગતો ધરાવતા હોવાનું દર્શાવેલ ઉમેદવારોએ સામાન્ય વહીવટ વિભાગના તારીખ: ૦૧/૦૮/૧૯૯૦ ના ઠરાવના નમૂના મુજબ માન્ય રમતગમતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે. નિયત નમૂનાના પ્રમાણપત્ર મંડળની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.(લીંક-૧)

૬. ઉમેદવારે Ex .Servi ceman હોય તે કિસ્સામાં જે તે ખાતા તરફથી કરેલ Discharge Book અને ઓળખપત્ર લાવવાના રહેશે.

૭. વિકલાંગ ઉમેદવારોએ સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૦૪/૨૦૦૮ના પરીપત્ર ક્રમાંક: ૫૨૫/૧૦૨૦૦૮ /૪૬૯૫૪૦/ ગર થી તથા વખતો વખતના સુધારાથી નિયત થયેલ સુપ્રિન્ટેન્ડન્ટ / સિવિલ સર્જનનું તબિબી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

નોંધ: ક્રમ નં.(૧) અને (૨) માં દર્શાવેલ પ્રમાણપત્રો તમામ ઉમેદવારોને લાગુ પડશે. જ્યારે ક્રમ નં. (૩) થી (૭) ના પ્રમાણપત્રો જે ઉમેદવારોના કિસ્સામાં લાગુ પડતા હોય તે ઉમેદવારોએ લાવવાના રહેશે.

૮. પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ સ્થળે કોઇપણ ઉમેદવારની સાથે આવેલ વાલીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ સ્થળે ઉમેદવારો ધ્વારા મોબાઇલના ઉપયોગનો પ્રતિબંધ છે.

૯. ઉમેદવારે પોતાના કોઇપણ આઇડેન્ટીટી પ્રૂફ જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ કે પાનકાર્ડ અસલમાં અચૂક સાથે લાવવાનું રહેશે તેમજ તેની ૧ ઝેરોક્ષ નકલ સ્વ-પ્રમાણિત કરી આપવાની રહેશે.

૧૦. મહિલા ઉમેદવાર જો પરણિત હોય અને અરજી તેમજ પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર/સરકારી ગેઝેટ કે એફીડેવિટ રજૂ કરવાના રહેશે.

૧૧. વિધવા ઉમેદવારે પુનઃ લગ્ન ન કર્યા અંગે સોગંદનામું રજૂ કરવાનું રહેશે.

૧૨. જે ઉમેદવારો સરકારી સેવામાં ફિડર કેડરમાં ફરજો બજાવતા હોય તેવા ઉમેદવારોએ તેઓની કચેરી/ખાતાનું નોકરીમાં જોડાયા તારીખ/સમયગાળાનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે.

૧૩. અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે નિયત તારીખ અને સમયે ઉમેદવાર હાજર નહિ રહે તો ઉમેદવારને "ગેરહાજર" ગણી યાદીમાંથી ગેરહાજર ઉમેદવારનો બેઠક નંબર "કમી" કરવામાં આવશે અને ભવિષ્યમાં આ બાબતનો કોઈ હક્ક દાવો ધ્યાને લેવામાં આવશે નહીં. તેની ખાસ નોંધ લેવી. અનિવાર્ય કારણોસર (માંદગી કે કૌટુંબિક મરણ) પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમમાં હાજર ન રહી શકાય તેવા સંજોગોમાં કારણોના પુરાવા સાથે ઉમેદવારના નજીકના વાલી (મિત્ર સિવાય) અસલ પ્રમાણપત્રો સાથે પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમમાં હાજર રહી શકશે તથા આવા વાલીએ ઉમેદવારનું સંમતિપત્ર સાથે લાવવાનું રહેશે. સંમતિપત્રનો નમૂનો (લીંક-૨)

૧૪. ઉમેદવારોની પસંદગી તેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણીને આધીન રહેશે. ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્રો/ દસ્તાવેજોમાં અને ઉમેદવારની અરજીની વિગતોમાં જો કોઈ વિસંગતતા જણાશે તો આ બાબતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા જે કોઈ નિર્ણય કરવામાં આવે તે આખરી અને ઉમેદવારને બંધનકર્તા રહેશે.

૧૫. પ્રમાણપત્રોની ચકાસણી માત્રથી નિમણૂક માટેનો કોઈ હક્ક આપોઆપ ઉમેદવારને મળી જતો નથી. તેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. હાલમાં નિયત ૩૫ જગાઓ સામે કુલ-૫૯ ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે, પ્રમાણપત્રો ની ચકાસણી બાદ મંડળ દ્વારા કુલ-૩૫ ઉમેદવારોની પસંદગી યાદી અને કુલ જગાના ૨૫% ઉમેદવારોની કેટેગરી વાઈઝ પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. વધુમાં પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોમાંથી ઉપલબ્ધ જગા માટે ગેરહાજર રહેતા તથા ગેરલાયક ઠરતા ઉમેદવારોના કારણે જગા સામે વધારે સંખ્યામાં ઉમેદવારો બોલાવેલા હોવા છતાં કોઈ પણ કેટેગરીમાં ઉપલબ્ધ નહિં થાય તો મેરીટના ધોરણે જે તે કેટેગરીની જરૂરીયાત મુજબ વધારે ઉમેદવારો બોલાવવામાં આવશે.

૧૬. શારીરિક માપ દંડોની ચકાસણી ગૃહ વિભાગના તા.૨૪/૧૧/૨૦૦૮ના જાહેરનામા ક્રમાંક: GG /59/ 2008/ MKM/102007/267/ PT-13/E1 ના નિયમ ૩D ના Appendix x માં ઉલ્લેખિત A અને B વજન, ઉંચાઈ, છાતી, (પુરુષ ઉમેદવાર)ના માપ દંડો અંગે ચકાસણીની કાર્યવાહી મંડળની કચેરી ખાતે મેડિકલ ઓફીસરની હાજરીમાં હાથ ધરવામાં આવશે.